

નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર

હવે નીચે પ્રમાણે નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર કહેવામાં આવે છે—કે જે નિશ્ચય-પ્રત્યાખ્યાન સકળ પ્રવર્જયારૂપ સામ્રાજ્યની વિજ્ય-ધર્માના વિશાળ દંડની શોભા સમાન છે, સમસ્ત કર્માંની નિર્જરાના હેતુભૂત છે, મોક્ષની સીરી છે અને મુક્તિરૂપી શ્રીના પ્રથમ દર્શનની બેટ છે.

અહીં ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે.

આ, નિશ્ચયનયના પ્રત્યાખ્યાનના સ્વરૂપનું કથન છે.

**પરિત્યાગી જલ્દ્ય સમસ્તને, ભાવી શુભાશુભ વારીને,
જે જીવ ધ્યાવે આત્મને, પચખાણ છે તે જીવને. ૮૫.**

અન્વયાર્થ :—સમસ્ત જલ્દ્યને (—વચનવિસ્તારને) છોડીને અને અનાગત શુભ-અશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને પ્રત્યાખ્યાન છે. ॥૮૫॥

આ, અનંતયતુષ્યાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશનું કથન છે.

**કેવલદરશ, કેવલવીરજ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે,
વળી સૌખ્યમય છે જેહ તે હું—એમ જ્ઞાની ચિંતવે. ૮૬.**

અન્વયાર્થ :—કેવળજ્ઞાનસ્વભાવી, કેવળ-દર્શનસ્વભાવી, સુખ-મય અને કેવળશક્તિ-સ્વભાવી તે હું છું—એમ જ્ઞાની ચિંતવે છે. ॥૮૬॥

અહીં, પરમ ભાવનાની સંમુખ એવા જ્ઞાનીને શિખામણ દીધી છે.

નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણો-જુએ જે સર્વ, તે હું—એમ જ્ઞાની ચિંતવે. ૮૭.

અન્વયાર્થ :—જે નિજભાવને છોડતો નથી, કંઈ પણ પરભાવને ગ્રહતો નથી, સર્વને જાણો-દેખે છે, તે હું છું—એમ જ્ઞાની ચિંતવે છે. ॥૮૭॥

અહીં (—આ ગાથામાં), બંધરહિત આત્માને ભાવવો—એમ ભવને શિખામણ દીધી છે.

પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભાગબંધ વિરહિત જીવ જે
છું તે જ હું—ત્યમ ભાવતો, તેમાં જ તે સ્થિરતા કરે. ૮૮.

અન્વયાર્થ :—પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ રહિત જે આત્મા તે હું છું—એમ ચિંતવતો થકો, (જ્ઞાની) તેમાં જ સ્થિરભાવ કરે છે. ॥૮૮॥

અહીં સકળ વિભાવના સંન્યાસની (—ત્યાગની) વિધિ કહી છે.

પરિવર્જું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું;
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહલું. ૮૯.

અન્વયાર્થ :—હું મમત્વને પરિવર્જું છું અને નિર્મમત્વમાં સ્થિત રહું છું; આત્મા મારું આલંબન છે અને બાકીનું હું તજ્જું છું. ॥૮૯॥

અહીં (—આ ગાથામાં), સર્વત્ર આત્મા ઉપાદેય (—ગ્રહણ કરવાયોગ્ય) છે એમ કહ્યું છે.

મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આત્મા,
પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આત્મા. ૧૦૦.

અન્વયાર્થ :—ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં

તथा ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં તથા યોગમાં (-શુદ્ધોપ્યોગમાં) આત્મા છે. ॥૧૦૦॥

અહીં (-આ ગાથામાં), સંસારાવસ્થામાં અને મુક્તિમાં જીવ નિઃસહાય છે એમ કહ્યું છે.

જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે !

જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. ૧૦૧.

અન્વયાર્થ :—જીવ એકલો મરે છે અને સ્વયં એકલો જન્મે છે; એકલાનું મરણ થાય છે અને એકલો ૨જ રહિત થયો થકો સિદ્ધ થાય છે. ॥૧૦૧॥

એકત્વભાવનારૂપે પરિણમેલા સમ્યજ્ઞાનીના લક્ષણનું આ કથન છે.

મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;

બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાધ્ય છે. ૧૦૨.

અન્વયાર્થ :—જ્ઞાનદર્શનલક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાધ્ય છે. ॥૧૦૨॥

આત્મગત દોષોથી મુક્ત થવાના ઉપાયનું આ કથન છે.

જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વ હું ત્રિવિધે તજું;

કરું છું નિરાકાર જ સમસ્ત ચારિત્ર જે ત્રયવિધનું. ૧૦૩.

અન્વયાર્થ :—મારું જે કાંઈ પણ દુઃચારિત તે સર્વને હું ત્રિવિધે (મન-વચન-કાયાથી) તજું છું અને ત્રિવિધ જે સામાયિક (-ચારિત્ર) તે સર્વને નિરાકાર (-નિર્વિકલ્પ) કરું છું. ॥૧૦૩॥

અહીં (આ ગાથામાં) અંતર્મુખ પરમ-તપોધનની ભાવશુદ્ધિનું કથન છે.

સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં;
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪.

અન્વયાર્થ :—સર્વ જીવો પ્રત્યે મને સમતા છે, મારે કોઈ સાથે વેર નથી; ખરેખર આશાને છોડીને હું સમાધિને પ્રાપ્ત કરું છું. ॥૧૦૪॥

જે જીવ નિશ્ચયપ્રત્યાખ્યાનને યોગ્ય હોય એવા જીવના સ્વરૂપનું આ કથન છે.

અકૃપાય, ઉધમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે,
શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫.

અન્વયાર્થ :—જે નિ:કૃપાય છે, દાન્ત છે, શૂરવીર છે, વ્યવસાયી (-શુદ્ધતા પ્રત્યે ઉધમવંત) છે અને સંસારથી ભયભીત છે, તેને સુખમય પ્રત્યાખ્યાન (અર્થાત् નિશ્ચય-પ્રત્યાખ્યાન) હોય છે. ॥૧૦૫॥

આ, નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારના ઉપસંહારનું કથન છે.

જીવ-કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિયે કરે,
તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે. ૧૦૬.

અન્વયાર્થ :—એ રીતે જે સદા જીવ અને કર્મના ભેદનો અભ્યાસ કરે છે, તે સંયત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે. ॥૧૦૬॥

આ રીતે, શ્રીમદ્ભગવત્કુંદાચાર્યદિવપ્રાણીત શ્રી નિયમસાર પરમાગમનો નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર નામનો છદ્રો શ્રુતસ્કર્ષ સમાપ્ત થયો.

